

TOUCHWOOD ENTERTAINMENT LIMITED
 CIN: L92199DL1997PLC088865
 Regd. Off.: Plot No. 645 Near E.P.T Block, Sarojini Nagar, New Delhi -110023
 Website: www.touchwood.in Contact No: +91 9810108253

NOTICE

Pursuant to the Regulation 29 and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Monday, the November 9, 2020**, inter-alia, to consider and approve the Un-Audited Standalone Financial Results for quarter and half year ended September 30, 2020.

This information is also available on the website of the Company i.e. www.touchwood.in and the website of the National Stock Exchange of India Ltd. (i.e. www.nseindia.com), the Stock Exchange where the Company's shares are listed.

For Touchwood Entertainment Limited
 Sd/-
Manjit Singh
 Managing Director

Place: New Delhi
 Date: 29th October, 2020

Chemcon Speciality Chemicals Limited
 CIN: U24231GJ1988PLC011652
 Regd. Office: Block No. 355, Manjusar Kumpad Road, Village: Manjusar, Taluka: Savli, Vadodara - 391775. Tel: 0265 - 2981195
 Email: investor.relations@cspl.com, Website: www.cspl.com

NOTICE

NOTICE is hereby given pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company will be held on Friday, 06th November, 2020, inter alia, to consider, approve and take on record the unaudited financial results of the Company for the quarter and half year ended 30th September, 2020. Further details are available on i) the Company website at www.cspl.com and ii) Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com

For Chemcon Speciality Chemicals Limited
 Sd/-
Shahil Kapatel
 Company Secretary & Compliance Officer

Place: Vadodara
 Date: 29/10/2020

GUJARAT TERCE LABORATORIES LIMITED
 Reg Office: -122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar - 382729. CIN NO: L24100GJ1985PLC007753
 email: cs@gujaratterce.com website: www.gujaratterce.in

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 47 read with Regulation 29 and 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Saturday, 7th November, 2020 at 11.00 a.m. at D / 802, The First, B/H. Keshavbaug Party Plot, Vastrapur, Ahmedabad - 380015, to consider and approve of the unaudited financial results for the quarter and half year ended September 30, 2020.

For, Gujarat Terce Laboratories Limited,
 Sd/-
Ashka Solanki
 Company Secretary & Compliance Officer

Date: 29.10.2020
 Place: Ahmedabad

Cholamandalam Investment and Finance Company Limited
 Corporate Office : 1st Floor, "Dare House", No. 2, N.S.C. Bose Road, Chennai-600001.
 Surat Branch : B-111, ICC Business Center, Besides Kadiwala School, Opp. Civil Hospital, Majura Gate, Surat-3950002.

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002

Name of Borrower(s) & Address		Secured Assets			
1. Hiteshbhai Laljibhai Bhalala, 4, Sanskar Villa, Varachha Road, Surat-395006, 2. Varshaben Hiteshbhai Bhalala, 4, Sanskar Villa, Varachha Road, Surat-395006, 3. Vivek Diamond, 206, Kamla Estate, Varachha Road, Surat-395006		All the Piece & Parcel of Immovable Property Bearing Plot No. 4 Admeasuring 70.43 Sq. Mts., Along With Undivided Share Admeasuring 23.11 Sq. Mts. Totally 9.54 Sq. Mts. "Sanskar Villa", Situate at Revenue Survey No. 152, 153, 183, 184, Block No. 179, Block No. 179, Draft T.P. Scheme No. 22 (Sarhathana-Valka), O.P. No. 4, Final Plot No. 4/A & 4/B of Moje Sarhathana: Taluka: Kamrej, Dist: Surat with construction on it. Bounded By:			
Date of Loan	Account Number	Loan Amount	Date of Demand Notice	Outstanding Amount	NPA Date
30/09/2015	X0HERHE00001502222	Rs. 52,00,000/-	05/10/2020	Totalling Rs. 75,37,625.83 as on 18/09/2020 with further interest @ 18 % as per Arbitration Award dated: 26/12/2019	17/02/2020
12/12/2017	X0HERHE00002203815	Rs. 15,00,000/-			

Name of Borrower(s) & Address		Secured Assets			
1. Navinbhai Madhavjibhai Mangukya, Flat No. 102 Rushikesh Building-G, Nr. Sarhathana Community Hall, Nana Varachha, Surat-395006, 2. Divyakanthbhai N. Mangukya, Flat No. 102 Rushikesh Building-G, Nr. Sarhathana Community Hall, Nana Varachha, Surat-395006, 3. Hareram Gems, Flat No. 102 Rushikesh Building-G, Nr. Sarhathana Community Hall, Nana Varachha, Surat-395006, 4. Mira Divyakanth Mangukya, Flat No. 102, Rushikesh Building-G, Nr. Sarhathana Community Hall, Nana Varachha, Surat-395006		All the Piece and Parcel of Immovable Property bearing Flat No. 102, on the 1st floor, admeasuring 1272 Sq. Ft. i.e. 118.22 Sq. mts. along with 58.55 Sq. mts. Undivided Share in the land of "Rushikesh of Building No G", Situate at Revenue Survey No. 50, Block No. 81, admeasuring 20538 Sq. mts. T.P. Scheme No. 38 (Nana Varachha), Final Plot No. 43, admeasuring 14381 Sq. Mts. of Moje Nana Varachha, City of Surat. Bounded By: East : Open Margin & Building F, West: Lift & Flat No. 103, North: Flat No. 101, South: Open Margin.			
Date of Loan	Account Number	Loan Amount	Date of Demand Notice	Outstanding Amount	NPA Date
21/04/2016	X0HERHE00001652888	Rs. 46,50,000/-	05/10/2020	Rs. 60,94,140.25 as on 11/09/2020 with further interest @ 18 % as per Arbitration Award dated: 03/01/2019	31/08/2018

The Under signed is the Authorised Officer of Cholamandalam Investment & Finance Company Limited hereinafter called the secured creditor, under Rule 2(a) of the security interest [Enforcement] Rules framed under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. In pursuant to Name of Borrower's / Co-Borrower's / Guarantor's & Address mentioned in column [A] Secured Assets in column [B] Date of Loan in column [C] Account Number in column [D] Loan Amount in column [E] Demand Notice Date in column [F] Outstanding Amount in column [G] NPA Date in column [H] Towards the due repayment of loan, equitable mortgage by deposit of title deeds of the assets in column [B] was created by the borrowers.

On persistent default in repayment of the loan amount the loan accounts of the borrowers have been classified by the secured creditor as Non Performing Asset column (H) accordance with the directions and guidelines issued by the Reserve Bank of India. Consequently notice under Sec. 13(2) of the Act was also issued to each of the borrowers on the dated mentioned in column [F], which have been returned undelivered. I state the under section 13(3) of the Securitisation Act, you can redeem the secured asset by payment of the entire outstanding including all costs, charges and expenses before notification of sale.

In view of the above the above named borrowers are called upon to discharge in full their liabilities towards the Secured Creditor by making the payment of the entire outstanding indicated in Column [G] above including up to date interest, costs and charges within 60 days from the date of notice, failing which, the creditor shall be entitled to take possession of the Secured Asset and shall also take such other actions as is available to the Secured Creditor in law. In the absence of full discharge of dues even after the transfer of secured assets the secured creditor reserves its right to proceed against the borrowers before a Sole Arbitrator, in terms of the Loan Agreement. In addition the above named borrowers shall not alienate by way of transfer, sale lease or otherwise or create third party interest or dealing with the Secured Asset in column [B] mentioned against the name of the each borrowers in any manner except with specific prior written permission of the secured creditor.

Sd/-
 Authorized Officer,
 Cholamandalam Investment and Finance Company Limited
 Place : Surat

YES BANK Regd. Office : YES Bank Ltd., ONE International Center, Tower II, 15th Floor, Senapati Bapat Marg, Elphinstone (W) Mumbai 400 013. CIN: L65190MH2003PLC143249, Email: communications@yesbank.in, Website: www.yesbank.in
 Branch : 1st Floor, Orbit Tower, Opp Krushi Bazar, Near Sahara Darwaja, Surat

POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorized Officer of YES Bank Limited, under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 has issued Demand Notice under Section 13(2) of the said Act calling upon the below mentioned Borrower/Co-Borrower/Mortgagor to repay the amount mentioned in the said notice together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from date of Demand Notice till the date of payment and/or realisation within 60 days from the date of the said notice. The borrower mentioned herein above having failed to repay the amount, notice is hereby given to the borrower mentioned hereinabove in particular and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with the Rule 8 of the said Rules.

The borrower mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the said property and any dealings with the said property will be subject to the mortgage of YES Bank Limited, for below amount together with further interest at contractual rates on the aforesaid amount, incidental expenses, costs, charges, etc. incurred from date of Demand Notice. As contemplated U/s. 13(8) of the Act, in case our dues together with all costs, charges and expenses incurred by us are tendered at any time before the date fixed for sale or transfer, the secured asset shall not be sold or transferred by us, and no further step shall be taken by us for transfer or sale of that secured asset.

S. No.	Name & Address of Borrower, Mortgagor & Co-Borrower	Description of the Mortgaged Properties	Total Outstanding Dues Rs.	Date of Demand Notice / Date of Possession
1	Mr. Ankitbhai Tulshibhai Khunt (Borrower & Mortgagor) and Mrs. Umaben Ankitbhai Khunt (Co Borrower) Loan A/c No.: AFH001100214751 & AFH001100214759	Property -1 : All the piece and parcel of immovable property Plot No-120, admeasuring 66.98 sq.mtrs of the Society known as "Royal Residency" Vibhag-2, along with undivided proportional share admeasuring 43.48 sq.mtrs in the land of Block 526/A/1 situated of Moje Kudsad, Sub District Olpad, District- Surat and bounded as under : East : Plot No-119, West : Plot No-121, North : Plot No-115, South : Society Road	Rs. 33,60,847/- (Rupees Thirty Three Lakhs Sixty Thousand Eight Hundred Forty Seven Only) being outstanding as on 11/07/2019	12/07/2019 27/10/2020
2	Mr. Laljibhai V Panchal (Borrower & Mortgagor) and Ms. Hemlatiben L Panchal (Co Borrower) Loan A/c No.: AFH001100310169	All piece and parcel of Plot No 197, Admeasuring 66.98 Sq. mtrs. Along with 38.92 Sq. mtrs. Undivided share in the land of road and C.O.P. in "Royal Residency" situated at Block No 526/A/2 admeasuring 18763 Sq. mtrs. Of Moje Village, Kudsad, Tal. Olpad Surat.	Rs. 15,89,755/- (Rs. Fifteen Lakhs Eighty Nine Thousand Seven Hundred Fifty Five Only) being outstanding as on 05/03/2019	07/03/2019 27/10/2020
3	Mr. Vastani Pravinbhai Parsolambhai (Borrower & Mortgagor) and Mrs. Vastani Ranjanben Pravinbhai (Co Borrower & Mortgagor) Loan A/c No.: AFH001100260443	All that piece and parcel of the Residential Plot No. 133, Land area admeasuring 66.98 sq.mtr., Undivided Proportionate Land of Road C.O.P. admeasuring 43.48 sq. mtr., of which Total area admeasuring 110.46 sq. mtr., scheme known as "Royal Residency Vibhag-2", situated at Block No. 526/A/1, in the sim of village Kudsad, Sub. Dist. Olpad, Dist. Surat and bounded as under: East : Plot No. 134, West : Plot No. 132, North : Society Road, South : C.O.P.	Rs. 18,48,345.94/- (Rupees Eighteen Lakhs Forty Eight Thousand Three Hundred Forty Five Paise Only) being outstanding as on 30/06/2020	02/07/2020 27/10/2020
4	Mr. Panelya Laljibhai Vithalbhai (Borrower & Mortgagor) and Mrs. Panelya Hansaben Vithalbhai (Co Borrower & Mortgagor) Loan A/c No.: AFH001100480694 & AFH001100502313	All that piece and parcel of Flat No. 502, Building No. 1-2, 5th Floor, Supor Built up area admeasuring 54.35 Sq. Mtr., Built up area admeasuring 35.88 Sq. Mtr., Undivided Proportionate Land area admeasuring 27.52 Sq.Mtr., scheme known as "Dharmannandan Township-1", situated at F.S. No. 104/1+2+3, 103/4, 121/1, 151/1 and 119/9, Block No. 189B, in the sim of Village Sayan, Sub. Dist. Olpad, District- Surat and bounded as under: North : C.O.P., South : C.O.P., East : Open Space, West: Block No. 188	Rs. 8,06,362.86/- (Rupees Eight Lakhs Six Thousand Three Hundred Sixty Two and Eighty Six Paise Only) being outstanding as on 30/06/2020	02/07/2020 27/10/2020

Date : 27.10.2020
 Place : Surat
 Sd/-
 (Authorized Officer)
YES Bank Limited

Johnson Controls-Hitachi Air Conditioning India Limited
 Regd. Office: 9th Floor, Abhijeet, Mithakhali Six Roads, Ahmedabad : 380 006 CIN: L29300GJ1984PLC007470
 Tel: + 91 7926402024, E-mail: hitachi@jci-hitachi.com, Website: www.jci-hitachi.in

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30/09/2020
 (Rs. in Millions)

Sr. No.	Particulars	Quarter ended		Year ended
		30/09/2020	30/09/2019	
		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations	3,117.4	3,795.3	22,055.2
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(254.2)	(79.3)	1,190.6
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(254.2)	(79.3)	1,183.1
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(190.3)	(6.4)	835.3
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(188.1)	(5.9)	804.5
6	Equity Share Capital (Face value Rs.10 per share)	271.9	271.9	271.9
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)			6,613.3
8	Basic and Diluted Earnings Per Share (before and after extra ordinary items) (of Rs. 10 each) (Not annualised) (Rs.)	(7.0)	(0.3)	30.7

Notes :
 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com, www.nseindia.com) and the company's website (www.jci-hitachi.in).

2. The above financials results are prepared in compliance with Indian Accounting Standard ("Ind AS") as notified under section 133 of the Companies Act, 2013 ("the Act") [Companies (Indian Accounting Standards) Rules, 2015], as amended.

Place : New Delhi
 Date: October 29, 2020
 For and on behalf of the Board of Directors
 Gurmeet Singh
 Chairman & Managing Director

DEBTS RECOVERY TRIBUNAL - II
 (Government of India, Ministry of Finance)
 3rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat.

FORM NO.22 [Earlier 62] [REGULATION 36 & 37 OF DRT REGULATIONS 2016]
 [See Rule 52(1) (2) of the SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961]
 READ WITH THE RECOVERY OF DEBTS AND BANKRUPTCY ACT 1993

E-AUCTION / SALE NOTICE
 THROUGH REGD. A.D./DASTI/AFFIXATION/BEAT OF DRUM/PUBLICATION

RP/ RC No. 2154 O.A.No. 38/2001
 Certificate Holder Bank **Bank of Baroda (earlier Dena Bank)**
Vs
 Certificate Debtors **M/S ARHAT INDUSTRIES LTD. & OTHERS**

To,
C.D. No. 1 : M/s Arhat Industries Ltd. & Others
 Ratnadeep Building, 2nd Floor, Opp. Fire Brigade Station, Ring Road, Surat - 395002.

Since the aforesaid CDs have failed to pay an amount of **Rs. 5,58,49,195.37** in terms of judgement and decree dated 28-01-2005, passed in O.A no.38/2001, as per my order dated 21-10-2020 the under mentioned property will be sold by public e-auction in the aforesaid matter. The auction sale will be held through "Online e-auction" website <https://www.drt.auctiontiger.net>.

Lot no.	Description of property	Reserve Price rounded off (in Rs)	EMD @ 10% or rounded off (in Rs)
1	Industrial Shed Property : Industrial Medium Size of Property at Moje Kumvarda bearing Block No.47 Paiki, Plot No. 252 to 283 (Total 32 Plots) behind Hansa Packaging, Kharach - Kosamba Road, Kumvarda, Tal. Mangrol, Dist. Surat, Total Area approximates 3993.43 sq.mtrs.	Rs. 48.60 lakhs	Rs. 5.00 lakhs

1	Revenue assessed upon any of the property or any part thereof.	No information available
2	Details of any other encumbrances to which property is liable.	No information available
3	Claims, if any which have been put forward to the property, and any other known particulars bearing on its nature and value.	No information available

EMD shall be deposited through RTGS/NEFT as per schedule given below in the account as per details as under:

Beneficiary Bank Name	BANK OF BARODA
Beneficiary Account No.	03330200001526
Branch Address	BOB ASSET RECOVERY MANAGEMENT BRANCH, AHMEDABAD
IFSC Code	BARBONAVRAN (fifth Character is Zero)

1) The bid increase amount will be Rs.10,000/-
 2) Prospective bidder may avail online training from service provider M/s E procurement Technologies Ltd. (Tel. Helpline No.+079-94005416/17/18/19) and Mr. Chintan Bhatt (Mobile No.09978591888), helpline E mail ID: support@auctiontiger.net and for any property related queries may contact Mr. Jayesh Parmar, Nodal Officer, (Mob.No. 7359922744) Prospective bidders are advised to visit website <https://www.drt.auctiontiger.net> for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
 3) The Prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after close of auction and 75% within 15 days from the date of Auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day.
 4) Properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence property.
 5) Schedule of auction is as under:-

1) Inspection of Property	23-11-2020 between 11.00 am to 02.00 pm
2) Last date for receiving bids alongwith earnest money and uploading documents including proof of payment made	09-12-2020 upto 05.00 p.m.
3) E auction	10-12-2020 between 12.00 pm to 02.00 pm (with auto extension clause of 5 minutes, provided sale shall be completed by 03.00 pm)

Date : 21-10-2020
 Recovery Officer,
 Debts Recovery Tribunal-II,
 Ahmedabad

Mutual Funds
 Aditya Birla Sun Life Mutual Fund

ADITYA BIRLA CAPITAL
 PROTECTING INVESTING FINANCING ADVISING

Aditya Birla Sun Life AMC Limited (Investment Manager for Aditya Birla Sun Life Mutual Fund) Registered Office: One India Bulls Centre, Tower 1, 17th Floor, Jupiter Mill Compound, 84-1, S.B. Marg, Elphinstone Road, Mumbai - 400 013. Tel: 4356 8000. Fax: 4356 8110/8111. CIN: U65991MH1994PLC080811

A. Addendum No. 14/2020
Notice-cum-Addendum to the Statement of Additional Information ("SAI") of Aditya Birla Sun Life Mutual Fund
Appointment of Director on the Board of Aditya Birla Sun Life Trustee Private Limited (ABSLTPL)
NOTICE IS HEREBY GIVEN THAT, Mr. Debasish Mallick has been appointed as an Independent Director on the Board of ABSLTPL with effect from Wednesday, October 28, 2020.
 In view of the above, a brief profile of the Director is given below:

Name	Age & Qualifications	Brief Experience
Mr. Debasish Mallick (Independent Director)	61 years MA (Economics), CAIIB and BA (Hons.)	Mr. Debasish Mallick was appointed as Deputy Managing Director of Export-Import Bank of India by Government of India for the period July 2014 to July 2019. During this stint he was responsible for overall business and operational activities of the Bank- both domestic & overseas. He has also served as MD & CEO of IDBI Asset Management Limited for the period April 2011 to July 2014 where he was responsible for setting up the vision statement, business model, fund management principle and broad guidelines, systems & processes, marketing and sales relationship network, organisation setup, regulatory compliances etc. He also developed a robust and sustainable business model in short span of time. Mr. Mallick has also served as Chief General Manager of IDBI Bank Limited where he was responsible for Project Finance, Retail Banking, Alternate Channels and Retail Business-Western Zone.

All other features and terms & conditions of the SAI will remain unchanged.
 This Notice-cum-Addendum forms an integral part of the SAI read with the Addenda issued thereunder.

B. Addendum No. OPT/10/2020
Notice-cum-Addendum to the Scheme Information Document / Key Information Memorandum of the Schemes of Aditya Birla Sun Life Mutual Fund
Investors / Unit holders are advised to take note of the following closure of Official Point of Acceptance of Transactions ("OPAT") in the Schemes of Aditya Birla Sun Life Mutual Fund.
Closure of existing OPAT of Aditya Birla Sun Life AMC Limited.

State	Address	Effective Date
Gujarat	2nd Floor, Dinesh Complex, Behind Anandnagar MTS Bus Stop, Anandnagar Road, Prahladnagar, Ahmedabad - 380 051.	Friday, October 30, 2020

This Notice-cum-Addendum forms an integral part of the Scheme Information Document / Key Information Memorandum issued for the Schemes read with the addenda issued thereunder.

For Aditya Birla Sun Life AMC Limited
 (Investment Manager for Aditya Birla Sun Life Mutual Fund)
 Sd/-
Authorised Signatory
 Date: October 29, 2020
 Place: Mumbai

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.